



22<sup>nd</sup> April, 2021

**BSE Ltd.**  
P.J. Towers,  
Dalal Street  
Mumbai-400 001

Code:502180

**National Stock Exchange of India Ltd.**  
Exchange Plaza,  
Bandra-Kurla Complex,  
Bandra(East)  
Mumbai-400 051

Code: SHREDIGCEM

Dear Sir,

**Sub: Publication/Advertisement in Newspapers for intimation to the Board Meeting of Shree Digvijay Cement Company Limited (the Company) for considering the Audited Financial Results for the Quarter and Financial Year ended March 31, 2021.**

In terms of provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a notice of the Board Meeting is scheduled on 28.04.2021, to consider and approve the Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and year ended 31<sup>st</sup> March 2021, has been published in Financial Express (all India edition -English) and Financial Express Gujarati on April 6,2021 by the Company.

Copies of the same is attached for your information and records.

Thanking you,  
Yours truly,  
**For Shree Digvijay Cement Company Limited**

*For* Suresh Meher  
VP(Legal) & Company Secretary

Encl. : As-above

**SHREE DIGVIJAY  
CEMENT CO. LTD.**

📍 **Registered Office & Works**  
Post- Digvijaygram 361140, Jamnagar,  
Gujarat, India.  
CIN L26940GJ1944PLC000749

☎ +91 288 234 4272-75  
☎ +91 288 234 4092  
✉ info@digvijaycement.com  
www.digvijaycement.com

## FRESH RESTRICTIONS MFIs don't see hiccups in ops in Maharashtra

MITHUN DASGUPTA  
Kolkata, April 5

**MICROFINANCE PLAYERS** DO not foresee any further hiccup in operations, including collection, in Maharashtra despite the state government's announcement of a slew of Covid-19 restrictions to curb the rapid spread of infections.

Microfinance industry association MFIN believes "in no way" collections will be impacted in Maharashtra due to stringent restrictions imposed by the state government from Monday.

"In no way, collections will be impacted because microfinance has been declared by the government of India as an essential service. Also, under the Covid protocols, microfinance group meetings are now taking place with not more than five people. I don't see any trouble for microfinance players in Maharashtra," MFIN CEO and director Alok Misra told FE.

According to Misra, on a pan-India basis, the collection efficiency for the microfinance industry has improved to over 90%, except in Assam and some pockets of West Bengal.

Some major microfinance players said their collection efficiencies in Maharashtra, have remained a bit less than the national average because it continues to report a large number of cases.

"As microlenders have already modified their model for collections, fresh restrictions in Maharashtra will not have any impact. Now, large group meetings are not taking place. Sometimes they are even making doorstep cash collections," said Chandra Shekhar Ghosh, MD and CEO of Bandhan.

**MFIN believes "in no way" collections will be impacted due to stringent restrictions**

"Fresh set of restrictions like complete weekend lockdowns could impact operations a little bit. But it can be managed," said Dibyajyoti Pattanaik, director of Pbbaneshwar-based MFI Annapurna Finance.

Sa-Dhan, an RBI recognised self-regulatory organisation for MFIs, believes that like banks, MFIs will be able to function in Maharashtra. "But it (stringent restrictions) could affect income flows for urban micro-finance borrowers. We are having consultations with member MFIs on Tuesday," executive director P Satish told FE.

## RBI rejigs portfolios of deputy governors

PRESS TRUST OF INDIA  
Mumbai, April 5

**THE RESERVE BANK** of India on Monday rejigged portfolios of deputy governors, with the key monetary policy department remaining with Michael Debabrata Patra.

The reshuffle follows the retirement of deputy governor BP Kanungo on completion of one-year extension.

As deputy governor, Kanungo headed the departments of currency management, information technology, payment and settlement systems, foreign exchange, and internal debt management.

Now, the central bank has reshuffled its 32 departments among the three deputy governors — M K Jain, Patra and M Rajeshwar Rao.

Besides the portfolio of monetary policy department, Patra has been assigned 10 other departments, the RBI said in a statement.

Jain has been assigned 11 departments, including of co-ordination, information technology, supervision, financial inclusion and development, human resource management, and premises.

As per the RBI's statement, Rao will look after 10 departments, including regulation, communication, currency management, payment and settlement systems, legal, foreign exchange and risk monitoring.

## SBI Card brings back former CEO as board director

SBI CARDS AND Payment Services (SBI Card) on Monday said it has appointed former

MD and CEO Ashwini Kumar Tewari as a nominee director on its board with immediate

effect. The board at its meeting held on Monday approved the appointment. **PTI**

## MADHYA PRADESH HOUSING & INFRASTRUCTURE DEVELOPMENT BOARD

Date : 03.04.2021

### NOTICE INVITING TENDER

Madhya Pradesh Housing & Infrastructure Development Board (MPHIDB) hereby invites Online proposals through e-tendering mode from reputed consultants for Selection of Consultant for preparation of Feasibility Report, DPR, Architectural Services, Preparation of Tender document and bid process for construction and development of Various Projects, Facilities and other miscellaneous works at Rewa under Redensification Policy of GoMP (Approximate Project cost Rs. 122.17 Crore (One hundred twenty two point one seven crores))

E-Tender No.	Name of Work	Cost of Tender Document	Earnest Money Deposit (EMD)
2021_MPHID_138099_1 (1st Call)	Selection of Consultant for preparation of Feasibility Report, DPR, Architectural Services, Preparation of Tender document and bid process for construction and development of Various Projects, Facilities and other miscellaneous works at Rewa under Redensification Policy of GoMP (Approximate Project cost Rs. 122.17 Crore (One hundred twenty two point one seven crores))	Rs. 12,500/- (Twelve thousand five hundred only)	Rs. 1,00,000/- (Rupees One lakh only)
2021_MPHID_138263_1 (2nd Call)	'Request for Proposal (RFP) for Selection of Consultant for Preparation of DPR, Architectural Services, Preparation of tender documents & Bid Process for construction & Development of Dharmshala, Residential quarters & renovation of Temple and other development work at Pramod Van Chitrakoot, Distt. Satna under PPP Model.' (Approximate Project cost Rs.10.00 Crore (Ten crores))	Rs. 10,000/- (Ten Thousand only)	Rs. 50,000/- (Rupees Fifty Thousand only)

- The bid documents can be purchased online only at [www.mptenders.gov.in](http://www.mptenders.gov.in) as per schedule : **05.04.2021 at 10:30 A.M. to 24.04.2021 at 05:30 P.M.**
  - Interested bidders can view the detailed NIT on website [www.mphousing.in](http://www.mphousing.in) and <https://www.mptenders.gov.in>.
  - Key Dates are available on e-tender website.
  - Amendments to NIT if any would be published on website only, and not in newspapers.
- Visit us : [www.mphousing.in](http://www.mphousing.in)  
Email : [dchcbrwa@mp.gov.in](mailto:dchcbrwa@mp.gov.in)  
M.P. Madhyam/100510/2021
- (N.K. Verma)**  
**DY. HOUSING COMMISSIONER**  
Circle- Rewa, Mob. : 090095-53612

## POST-OFFER PUBLIC ANNOUNCEMENT FOR THE ATTENTION OF THE EQUITY SHAREHOLDERS OF REMI SALES AND ENGINEERING LIMITED

Corporate Identification Number ("CIN"): L31100MH1980PLC222314  
Registered Office: Plot No.11, Cama Industrial Estate, Goregaon (East), Mumbai - 400 063, Maharashtra, India.  
Tel No. +91-22-40589888; Email: [rsse\\_igrd@remigroup.com](mailto:rsse_igrd@remigroup.com); Web: [www.remigroup.com](http://www.remigroup.com)

This Post Offer Public Announcement ("Post-Off PA") is being issued by Remi Securities Limited ("Promoter Acquirers 1"), K K Fincorp Limited ("Promoter Acquirers 2") and Bajrang Finance Limited ("Promoter Acquirers 3") (Promoter Acquirers 1, Promoter Acquirers 2 and Promoter Acquirers 3 are jointly referred to as the "Promoter Acquirers") to the public shareholders (as defined under Regulation 2(1)(v) of the Delisting Regulations (as defined below) and hereinafter referred to as "Public Shareholders") of Remi Sales and Engineering Limited (the "Company" or "RSEL") in respect of the proposed acquisition and consequent voluntary delisting of the fully paid-up Equity Shares of the Company with a face value of Rs. 10 each ("Equity Shares") from the BSE Limited ("BSE" or "Stock Exchange") pursuant to Regulation 10 and other applicable provisions of the Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009 ("Delisting Regulations") and in accordance with the terms and conditions set out in the public announcement dated March 09, 2021 and published on March 10, 2021 ("Public Announcement") in (i) Financial Express (English, All Editions), (ii) Jansatta (Hindi, All Editions) and (iii) Pratahkal (Marathi, Mumbai Edition), the Letter of Offer dated March 10, 2021 ("Letter of Offer").

This Post-Off PA is in continuation to and should be read in conjunction with the Public Announcement and the Letter of Offer. Capitalized terms used in this Post Offer PA and not defined herein shall have the same meaning as ascribed to it in the Public Announcement and the Letter of Offer.

The Public Shareholders holding Equity Shares were invited to tender their Equity Shares ("Bids") pursuant to the reverse book building process as prescribed in the Delisting Regulations through the Stock Exchange Mechanism made available by BSE during the Bid period starting from Monday, March 22, 2021 and ending on Friday, March 26, 2021 in accordance with the Delisting Regulations.

- DISCOVERED PRICE AND EXIT PRICE**
  - In terms of Regulation 15(1) of the Delisting Regulations, the price determined as Discovered Price is Rs. 15.50/- (Rupees Fifteen and Fifty Paise Only) per Equity Share. The final price decided by the Promoter Acquirers for accepting the Equity Shares successfully tendered in the Delisting Offer is Rs. 21.00/- (Rupees Twenty-One Only) per Equity Share (the "Exit Price").
- SUCCESS OF THE DELISTING OFFER**
  - In terms of Regulation 17(a) of the Delisting Regulations, this Delisting Offer would be deemed to be successful, only if a minimum number of 2,31,380 Offer Shares were tendered & acquired in the Delisting Offer at or below the Exit Price so as to cause the cumulative number of the Equity Shares held by the Promoter Acquirers along with other members of the Promoter Group, post the acquisition through the Acquisition Window Facility be equal to or in excess of 5,13,180 Equity Shares constituting 90% of the equity share capital of the Company.
  - The Promoter Acquirers shall acquire the 2,75,796 Equity Shares validly tendered at or below the Exit Price in the Reverse Book Building Process (RBBP) and post completion of the acquisition, the shareholding of the Promoter Acquirers along with other members of the Promoter Group shall be 97.79% of the fully paid-up equity share capital of the Company, which would exceed the minimum number of Equity Shares required i.e. 2,31,380 for the Delisting Offer to be successful in terms of Regulation 17(1)(a) of the Delisting Regulations.
  - In terms of Regulation 17(1)(b) of the Delisting Regulations, at least 25% of number of Public Shareholders holding Equity Shares in dematerialized mode as on March 09, 2021 ("Specified Date") should participate in the RBBP, provided that if the Promoter Group along with the Manager to the Offer demonstrates to the Stock Exchange that they have delivered the Letter of Offer of this Delisting Offer to all the Public Shareholders either through registered post or speed post or courier or hand delivery with proof of delivery or through email as a text or as an attachment to email or as a notification providing electronic link or uniform resource locator including a read receipt (the "LOF Delivery Requirement"), then the mandatory participation of aforementioned number of Public Shareholders is not applicable.
  - The Promoter Acquirers through Registrar to the Offer has sent the Offer Letter/Bid Letter of this Delisting Offer to all the Public Shareholders on or before March 15, 2021 through speed-post or registered-post with proof of dispatch and also through email as an attachment to email to those Public Shareholders whose email id is registered with their respective depositories. Proof of dispatch to all Public Shareholders has been submitted to the Stock Exchange as a proof, in accordance with the proviso to Regulation 17(1)(b) of the Delisting Regulations.
  - The Delisting Offer is thus deemed to be successful in terms of the Delisting Regulations.
  - All Public Shareholders of the Company who have validly tendered their Equity Shares at or below the Exit Price will be paid the consideration at the Exit Price of Rs. 21/- per Equity Share. The last date for payment of consideration to all the Public Shareholders (in respect of whom no regulatory approvals are required) and whose Bids have been accepted will be Friday, April 09, 2021.
  - The Equity Shares of the Public Shareholders whose Bids have been rejected, will be returned to the Public Shareholders in accordance with the Methods of Settlement contained in Paragraph 18 of the Public Announcement, the Letter of Offer read with the SEBI Circulars.
  - Subsequently, the Company will initiate the necessary steps to delist Equity Shares of the Company from BSE Limited. The date of delisting of Equity Shares shall be announced in the same newspapers in which the PA and this Post-Off PA has appeared.
- OUTSTANDING EQUITY SHARES AFTER DELISTING**
  - In accordance with Regulation 21 of the Delisting Regulations, all Public Shareholders who continue to hold shares after the Reverse book Building Process ("Residual Shareholders") will be able to offer their Equity Shares to the Promoter Acquirers at the Exit Price for a period of one year following the date of the delisting from the Stock Exchange ("Exit Window").
  - A separate offer letter (the "Exit Letter of Offer") in this regard will be sent to such Residual Shareholders which will contain terms and conditions for participation in Exit Offer. Such Residual Shareholders may tender their Equity Shares by submitting the required documents to the Registrar to the Offer within the stipulated time period as will be set out in the Exit Letter of Offer.

If any shareholders have any query with regard to the Delisting Offer, they should consult the Manager to the Offer or the Registrar to the Offer (details appearing below). All other terms and conditions of the Delisting Offer as set forth in the Public Announcement and the Letter of Offer remain unchanged. This Post Offer PA is also expected to be available on the website of the Stock Exchange ([www.bseindia.com](http://www.bseindia.com)) and on the website of the Company.

MANAGER TO THE OFFER	REGISTRAR TO THE OFFER
<p><b>SYSTEMATIX GROUP</b> Investments Re-defined</p> <p>Systematix Corporate Services Limited The Capital, A-Wing, 6th Floor, No. 603-606, Plot No. C-70, G-Block, Bandra-Kurla Complex (BKC), Bandra (East), Mumbai 400 051, Maharashtra, India Telephone: +91-22-6704 8000 Fax: +91-22-6704 8022 Email: <a href="mailto:ecm@systematixgroup.in">ecm@systematixgroup.in</a> Contact Person: Mr. Amit Kumar Website: <a href="http://www.systematixgroup.in">www.systematixgroup.in</a> SEBI Registration Number: INM000004224 Validity Period: Permanent</p>	<p><b>Bigshare Services Private Limited</b> Bharat Tin Works Building, 1st Floor, Opp. Vasant Oasis, Makwana Road, Andheri - East, Mumbai - 400059, Maharashtra, India Telephone: +91-22-62638200; Fax: +91-22-62638280; Contact Person: Mr. Arvind Tandel Email: <a href="mailto:delisting@bigshareonline.com">delisting@bigshareonline.com</a> Website: <a href="http://www.bigshareonline.com">www.bigshareonline.com</a> SEBI Registration Number: INR000001385 Validity Period: Permanent</p>
<p>For and on Behalf of the Promoter Acquirers</p> <p>Remi Securities Limited (Promoter Acquirer 1) Sd/- Sanjay Maheshwari Whole Time Director</p> <p>K K Fincorp Limited (Promoter Acquirer 2) Sd/- Shiv Kumar Sharma Whole Time Director</p> <p>Bajrang Finance Limited (Promoter Acquirer 3) Sd/- Mahabir Prasad Sharma Whole Time Director</p>	<p>Sd/- Pramod Jalan Director</p> <p>Sd/- Poonam Jangid Company Secretary</p> <p>Sd/- Pradeep Jalan Director</p> <p>Sd/- Vidhi Mehta Company Secretary</p> <p>Sd/- Nirmal Murarka Director</p> <p>Sd/- Nirmal Tiwari Company Secretary</p>
<p>Date: April 05, 2021 Place: Mumbai</p>	<p>Date: April 05, 2021 Place: Mumbai</p>

## Federal Bank's deposits grow 13% in Q4

FE BUREAU  
Kochi, April 5

**FEDERAL BANK'S DEPOSITS** rose 13% year-on-year during the fourth quarter of the previous fiscal, while gross advances reported a 9% Y-o-Y growth, the bank said in a regulatory filing.

The lender said at the end of March 2021 quarter, total deposits stood at ₹172,655 crore, against ₹152,290 crore in the year-ago period.

Advances at the end of the fourth quarter stood at ₹134,876 crore, compared with ₹124,153 crore in the same period last year.

CASA is seen at a ₹58,381 crore during Q4, an 8-y-o-y increase of 26%. The CASA ratio is reported at 33.81%.

The liquidity coverage ratio was at 206.91% for the March quarter.

**BIECO LAWRIE LTD.**  
CIN: U51909WB1919PLC003559  
Regd. Office: 6 Mayurbhaj Road  
Kolkata-700023

NOTICE is hereby given that the 99<sup>th</sup> Annual General Meeting of the Members of Biecco Lawrie Limited will be held on **28.04.2021 at 11.30 A.M.** through WEBEX platform. Login credentials containing user id and password for the meeting will be e-mailed to the registered e-mail address. Members of the Company are requested to register their e-mail addresses enabling them to receive Notice of 99<sup>th</sup> Annual General Meeting of the Company in electronic form as per Ministry of Corporate Affairs' Circulars by sending e-mail at [bieccolawrie1919@gmail.com](mailto:bieccolawrie1919@gmail.com) along with Name of Shareholder(s), Copy of Share Certificates and Self attested Address proof before **20.04.2021**. No physical copy of Notice shall be sent to Members.

For Biecco Lawrie Limited  
Sd/- Adika R. S.  
Managing Director  
Dated: 06.04.2021

**JSW Steel Limited**  
CIN : L27102MH1994PLC152925  
Regd. Office: JSW Centre, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051.  
Tel.: 022-4286 1000 Fax: 022-4286 3000 Email: [jswl.investor@jsw.in](mailto:jswl.investor@jsw.in) Website: [www.jsw.in](http://www.jsw.in)

**NOTICE OF LOSS OF SHARE CERTIFICATES**  
Notice is hereby given that the Share Certificates in respect of the following Equity Shares have been reported to be lost/misplaced and the Shareholders thereof have applied for duplicate Share Certificates in lieu thereof.

Folio No.	Name/Joint Names	Share Certificates			No. of Shares
		Certificate No(s)	From	To	
JSWI1183061	ANURADHA GUPTA	256019	238735581	2387336010	30
JSWI1228838	SURENDRAN P P	2629302	2400273481	2400273500	20
JSW0318615	MEENA RAHEJA	2463713	2383509891	2383510100	210
JSWI178670	NIRAJ KHANDELWAL	2567313	2392592761	2392593760	1000
JSWI153407	SURESH KUMAR K & LEENA S	2651721	2407387721	2407387760	40

Any person who has a claim on the above Share Certificates is requested to contact the Company at its Registered office within 15 days, failing which the Company will proceed to issue duplicate certificates.

Place : Mumbai  
Date : 05-04-2021  
For JSW Steel Limited  
Sd/- Lancy Varghese  
Company Secretary

**NMDC Limited**  
(A GOVERNMENT OF INDIA ENTERPRISE)  
Donimalai Complex, Donimalai Township, Po-Sandur Taluk, Ballari Dist.  
Karnataka, 581118  
CIN : L13100TS1958G001674.

**TENDER NOTIFICATION**  
Sealed tenders in two bid system are inviting from the competent, experienced and financially sound contractors for the following work:

Sl. No.	Tender No. & Date	Name of Work	Cost of Work	Sale / download period	Last date of Submission up to 15.00 Hrs
1	CE/W/9 (16/9/2021) Date: 06/04/2021	"Afforestation of 15,000 Saplings works at DIOM (Gap Plantation, ML No.2395) for the Year 2021-22 as per R & R Plan including 3 Years Maintenance after planting of sapling"	₹57.09 Lakhs	From 06/04/2021 to 05/05/2021	05/05/2021
2	CE/W/9 (16/9/2021) Date: 06/04/2021	"Afforestation of 10,000 Saplings works at KIOM Plot-I, C-Block area (ML No.111) for the Year 2021-22 as per R & R Plan including 3 Years Maintenance after planting of sapling"	₹38.17 Lakhs	From 07/04/2021 to 06/05/2021	06/05/2021
3	CE/W/9 (16/9/2021) Date: 06/04/2021	"Afforestation of 15,000 Saplings works at KIOM Plot-II, B-Block area (ML No.111) for the Year 2021-22 as per R & R Plan including 3 Years Maintenance after planting of sapling"	₹57.22 Lakhs	From 08/04/2021 to 07/05/2021	07/05/2021
4	DNM/PER/CA/HV/ TRNG/2021 Date: 08/04/2021	"Hiring of two (02) nos. of vehicles of 17*1 to 22 seaters capacity mini bus with AC (like Swaraj Mazda / Tempo Traveler...etc.), 2018 model onwards to perform the duty for transportation facility to NMDCL Personnel and their dependents from Donimalai Township to Toranagallu railway station and back"	₹18.43 Lakhs	From 08/04/2021 to 07/05/2021	07/05/2021

For further clarification; For Sl. No. 1 to 3 may contact by e-mail to [diomcivl@nmdc.co.in](mailto:diomcivl@nmdc.co.in) /fax No. 08395-274644 and For Sl. No. 4 may contact by e-mail to [diomperonne@nmdc.co.in](mailto:diomperonne@nmdc.co.in) /fax No. 08395-274009. Detailed NIT and tender documents can be viewed and/or downloaded from NMDC's website <https://www.nmdc.co.in/nmdctender/default.aspx> or Central Public Procurement Portal <https://www.eprocure.gov.in>.

Further, for any corrigendum, amendments, For and on behalf of NMDC Limited  
clarification etc may please follow the above website. General Manager (Production)

**BSE LIMITED**  
Registered office: 25<sup>th</sup> Floor, P J Towers, Dalal Street, Mumbai - 400001  
Tel.: +91 (022) 2272 1233 / 34 • CIN: L67120MH2005PLC155188

**PUBLIC NOTICE**  
Inviting claims against BEZEL STOCK BROKERS PVT. LTD. declared as defaulter as well as expelled

This is to inform that pursuant to declaration of Bezel Stock Brokers Private Limited as defaulter as well as its expulsion by NSE vide its circular no. 36/2021 dated March 25, 2021 w.e.f. March 24, 2021, the Exchange has declared Bezel Stock Brokers Private Limited (Cig. No. 6564), a corporate trading member, as defaulter, in terms of the provisions of SEBI Circular No. SEBI/MIRSD/Master Cir-04/2010 dated March 17, 2010 and also expelled the said trading Member in compliance with the requirement of Circular No. F. No. 1/26/SE/91 dated August 22, 1991 issued by Ministry of Finance (Department of Economic Affairs), Government of India, w.e.f. March 25, 2021.

Investors having any outstanding claims against Bezel Stock Brokers Private Limited are advised to file their claims with the Exchange, if they so desire, within 90 days from the date of issue of this notice ("specified period"), as provided under SEBI Circular No. MRD/DP/SE/Cir-38/2004 dated October 28, 2004, circular No. MRD/DP/06/2011 dated June 16, 2011, circular No. SEBI/HO/DMS/CIR/P/2017/15 dated February 23, 2017 and any other modifications/circulars as may be issued by SEBI in this regard, from time to time.

The investors can file their claim against Bezel Stock Brokers Private Limited at the concerned regional investor centre of BSE Ltd., the list of which is available on Exchange's website at the following link: [https://www.bseindia.com/static/investors/Claim\\_against\\_Defaulter.aspx](https://www.bseindia.com/static/investors/Claim_against_Defaulter.aspx)

The investors can also lodge their claims through Exchange's website under e-Complaint Registration, a link for which is given below: <https://bseers.bseindia.com/complaint/fmlinvestorHome.aspx>

The investors can also submit their claims along with documents on email id: [Claims.defaulter@bseindia.com](mailto:Claims.defaulter@bseindia.com)

The investors are hereby advised to go through the below mentioned Exchange website link for documentation requirement for filing their claim against defaulter, norms for eligibility of claims for recommending for compensation from IPF to the clients of the Defaulter Member, FAQs on processing of investors claims against defaulter members: [https://www.bseindia.com/static/investors/Claim\\_against\\_Defaulter.aspx](https://www.bseindia.com/static/investors/Claim_against_Defaulter.aspx)

The eligible claims filed before the end of aforesaid specified period would be considered for compensation from the investor centre of BSE Ltd. (IPF), as per the provision of SEBI circular no. CIR/MRD/DP/28/2014 dated September 29, 2014 to the maximum extent of Rs.15 Lacs per client. Further, investors filing their claims after the specified period are required to provide reasons for delay in filing the claim and should satisfy the IPF that the claim could not have been filed before the end of specified period for the reasons beyond the control of the claimant.

For BSE Limited  
Sd/- General Manager  
Dept. of Investors Services

Place: Mumbai  
Date : April 6, 2021

**MIZORAM UNIVERSITY**  
(NAAC 'A' Grade Central University)  
No. 1-1/Estt./I07/257 Date: 5th April, 2021  
Applications are invited in the prescribed format for filling up of **Finance Officer** latest by **20th April, 2021**. Details may be seen from Mizoram University website [www.mzu.edu.in](http://www.mzu.edu.in). Subsequent addendum/ corrigendum issued, if any, shall be posted in the University website only.  
Registrar

**Shree Digvijay Cement Company Ltd.**  
CIN: L26940GJ1944PLC000749  
Digvijaygram, Jamnagar - 361 140 (Gujarat)  
Email: [investors.sdcc@digvijaycement.com](mailto:investors.sdcc@digvijaycement.com) Website: [www.digvijaycement.com](http://www.digvijaycement.com)  
Phone 0288-2344272-75, Fax No. 0288-2344092

**NOTICE**  
Pursuant to Regulation 29 read with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Wednesday, **28<sup>th</sup> April, 2021, inter-alia**, to consider and approve the Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and year ended 31<sup>st</sup> March 2021. This Notice is also available at Investors Section of the Company's website [www.digvijaycement.com](http://www.digvijaycement.com) and on the Stock Exchanges website at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), where the shares of the Company are listed

For Shree Digvijay Cement Company Limited  
Sd/- Suresh Meher  
Place: Digvijaygram VP (Legal) & Company Secretary  
Date : 31<sup>st</sup> March , 2021

**ICICI PRUDENTIAL LIFE INSURANCE COMPANY LIMITED**  
CIN: L66010MH2000PLC127837  
Registered Office: 1089, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025, India  
Tel: 022 5039 1600; Fax: 022 2422 4484  
Website: [www.iciciprulife.com](http://www.iciciprulife.com); E-mail: [investor@iciciprulife.com](mailto:investor@iciciprulife.com)

NOTICE is hereby given that, in terms of Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Board of Directors of the Company will, inter alia, consider approval of the audited standalone and consolidated financial statements of the Company for the quarter and year ended March 31, 2021 and financial results of the Company for the quarter and year ended March 31, 2021 and the recommendation of dividend, if any, at its Meeting scheduled to be held on Monday, April 19, 2021.

Further, the details in connection with the notice will be available on the website of the Company at [www.iciciprulife.com](http://www.iciciprulife.com) and that of the stock exchanges i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).

For ICICI Prudential Life Insurance Company Limited  
Sonalik Chandak  
Company Secretary  
ACS 18108  
April 6, 2021  
Mumbai

**PRISM JOHNSON LIMITED**  
CIN : L26942TG1992PLC014033  
Registered Office : 305, Laxmi Niwas Apartments, Ameerpet, Hyderabad - 500 016  
Phone : +91-40-23400218 ; Fax : +91-40-23402249  
e-mail : [investor@prismjohnson.in](mailto:investor@prismjohnson.in) ; website : [www.prismjohnson.in](http://www.prismjohnson.in)  
Corporate Office : Rahejas, Main Avenue, V. P. Road, Santacruz (West), Mumbai - 400 054

**NOTICE**  
Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of **PRISM JOHNSON LIMITED** will be held on Thursday, May 6, 2021, to approve, *inter alia*, the Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2021.

This intimation is also available on the websites of BSE ([www.bseindia.com](http://www.bseindia.com)) and NSE ([www.nseindia.com](http://www.nseindia.com)) where the Company's securities are listed and shall also be available on the website of the Company [www.prismjohnson.in](http://www.prismjohnson.in).

By order of the Board of Directors,  
For Prism Johnson Limited  
Aneeta S. Kulkarni

